

ગરવી નવકાન્તિ



તંત્રી : પ્રશાંત ઘોણકીયા .મેનેજુંગતંત્રી : મિનાક્ષી ઘોણકીયા

kwws=22mdjdglvklkulvwldqlfrp
#hpdl=jduylqdynudqwl#C#|dkrr1frp

ESTD.YEAR- 24 • ISSUE: 47 DATE: 21-11-2020 • SATURDAY • PAGES: 4 • PRICE Rs.1 • YEARLY SUB: Rs. 60/-

ચુઅસ નવા પ્રેસિડેન્ટ બાઈડેનનું પોલીસી ડોક્યુમેન્ટ જારી : પાંચ લાખ ભારતીયોને માટે નાગરિકતાનો માર્ગ મોકણો કરશે

અમેરિકાના નવા ચુંટાયેલા પ્રેસિડેન્ટ જો બાઈડેન પાંચ લાખ ભારતીયો સહિત ૧ કરોડ ૧૦ લાખ અનાડોક્યુમેન્ટે ઈમીગ્રન્ટને અમેરિકાની નાગરિકતા આપવાનો રોડમેપ તૈયાર કરશે. તે ઉપરાંત દર વર્ષે ૮૫૦૦૦ નિરાશ્રિતોને અમેરિકામાં આશ્રય આપવાની જોગવાઈ કરશે. બાઈડેન કેમ્પેન દ્વારા જારી કરાયેલા પોલીસી ડોક્યુમેન્ટ અનુસાર ઈમીગ્રેશન આપવાની બનાવવા માટેના કાયદાકીય સુધીમાં માટે જો બાઈડેન કોએસ સાથે મળીને કામ કરશે. એચેવનભી વિજાની સંખ્યા વધારશે. એચ્યુની વર્ક પરમીટ નાભુદ કરવાનો નિર્ણય રદ કરશે. શ્રીનકાર્ડમાં ક્વોટા સિસ્ટમ હટાવવાની તૈયારી કરાઈ છે. અમેરિકામાં પીએચીડીની સાથે શ્રીનકાર્ડ આપવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો છે.

અમેરિકામાં કાયમી વસવાટ માટે



અપાટા શ્રીનકાર્ડમાં રહેલી દેશ પ્રમાણેની ક્વોટા સિસ્ટમ હટાવવાની જો બાઈડેન તૈયારી કરી રહ્યા છે. શ્રીનકાર્ડ સહિતના આપ્લોયમેન્ટ આધારિત વિજાની દેશ પ્રમાણેનો ક્વોટા દુર કરવાને સમર્થ આપશે. જેના પગલે અત્યાર સુધીમાં શ્રીનકાર્ડમાં ચાલી રહેલા બેકલોગનો અંત આવશે. હાલમાં દર વર્ષ શ્રીનકાર્ડ સહિત ૧,૪૦,૦૦૦ ઓપ્લોયમેન્ટ વિજા જારી કરવામાં આવે છે. બાઈડેન સરકાર પરિવાર આધારિત ઈમીગ્રેશનને સમર્થન આપશે અને પરિવારની અખંડિતતાના અમેરિકાના મુળભૂત સિધ્ધાંતને અનુસરશે. તે ઉપરાંત નોકરીના સ્થળો પર પડતા દરોડા બંધ કરાશે. એચ-વનભી સહિતના હાઈસ્ક્વિલ વિજાની સંખ્યામાં વધારો કરવાની યોજનાથી વિજાના જીવનસાથી અપાટી વર્ક પરમીટ નાભુદ કરવાના નિર્ણયને રદ કરી દેવાશે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ચરમ સીમા પર પહોંચ્યું

દિવાળીના તહેવારો સાથે વધેલી દંડીથી રાજ્યમાં કોરોના સંક્રમણ ભારે ઉધાળા સહિત આગળ વધી ગયું છે. છેલ્લા પાંચ દિવસો દરમિયાન કુલ નવા ૫૭૪૨ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયમાં ૫૫૪૪ જેટલા દર્દીને ડીસ્ક્યાર્જ કરી દેવાયા છે. જ્યારે ઉં઱ દર્દીઓના મોત નિપજ્યા છે. આ કેસોમાં પાંચમાં ભાગના કેસો એટલે ૨૧ ટકા કેસ ૧૦૬૭ એકલા અમદાવાદમાંથી આવ્યા છે. પાંચ દિવસના કુલ મૂલ્યમાંથી અડ્ઝો અડ્ઝ ૧૬ દર્દીઓના મોત અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં ફાટી નિકળેલા સંક્રમણથી સાત સરકારી અને ૭૬ ડેઝિનેટેડ કોવિડ ખાનગી હોસ્પિટલમાં પથારીઓ લગભગ ભરાઈ ગઈ છે. અંતે અમદાવાદ શહેરમાં સત્તાવાળાઓએ કરફયુની જાહેરાત કરવી પડી છે.

પાંચ દિવસમાં અમદાવાદ શહેરના પણ્યમિનિસ્ટ્રીસમાં કોરોનાએ

ગ્રાહક મિત્રોને વિનંતી.

આપનું #વાજ્મ બાકી છે/
પૂરું થયેલ છે. સરનામાની ટીકીકી
ચેક કરો. લવાજ્મ અને આર્થિક
સહયોગ મનીઓર્ડથી નીચેના
સરનામે મોકલી શકો છો.

ગરવી નવકાન્તિ સાપ્તાહિક

૨/૧૦ સોનિયા એપાર્ટ.
પીટીકોલેજ રોડ, નારાયણ
નગર અમદાવાદ - ૭
ફોન નં. ૬૮૨૪૧૬૬૩૮૬-

કોરોનાની ભયાવહ સ્થિતિને જોતાં ૨૩મીથી શાળા કોલેજોને શરૂ નહિ કરવાનો સરકારનો નિર્ણય

કેટલાક તહેવારો બાદ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણમાં ઉધાળો આવતાં શહેરની સ્થિતિમાં એકાએક ફેરફાર થયો છે. નવરાત્રિ તેમજ દિવાળીના તહેવારો બાદ શિયાળાના ઠંડક ભર્યા વાતાવરણે તેમજ ફિટકડાના વાયુ પ્રદૂષણે સંક્રમણની તેજુમાં વધારો કર્યો. પરિણામે રોજાંદા કેસોની સંખ્યામાં એકદમ વિસ્ફોટક વધારો નોંધાયો. પરિણામે સરકારે સંકટને ટાળવા માટે શુક્વાર રાત્રિથી સંખ્યા ૬૦ કલાકના કરફયુની જાહેરાત કરી નાંખી.

કરફયુની જાહેરાતની સાથે સરકારે અગાઉ ૨ ઉમી સ્કુલો, કોલેજો ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. તેને ટાળીને ફરીથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી શાળા કોલેજો ચાલુ નહી કરવાનો નિર્ણય જાહેર કર્યો.

કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે તેવા અણસારો દેખાતા હતા. પરંતુ તહેવારોમાં લોકોએ ભીડ કરી અને સંક્રમણ ટાળવાના નિયમોની અણાદેખી કરી. પરિણામ એ આવ્યું છે કે ભારે સંક્રમણ થયું. તેમાં હવામાન બદલાયું અને તેનાથી કેસો વધુ બન્યા છે તેવું કેટલાક લોકોનું માનવું છે. દિવાળીના તહેવારોમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો યોગ્ય અમલ કર્યો નહી. તેમજ માસ્ક વગર ખરીદી કરી તેનાથી સંક્રમણમાં ખુબ વધારો થયો. શહેરની મોટાભાગની હોસ્પિટલો ભરાઈ ગઈ છે. સરકારે તાત્કાલિક નવા વોર્ડ ખોલવા પડ્યા છે. હંડીના પગલે કોરોના વિકારણ સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત તથીબો વ્યક્ત કરી રહ્યા છે. કોરોનાની ગંભીર સ્થિતિ જોતાં સરકારે અમદાવાદમાં કરફયુની જાહેરાત કરવી પડી છે અને સોમવાર રાત્રીથી પણ કરફયુની જારી રહેશે તેવો નિર્ણય કર્યો છે.

૧૦૮ અભ્યુલન્સની સેવાઓને માટે તેના કર્મચારીઓને સલામ !



અમદાવાદ શહેરમાં સતત છેલ્લા પાંચ દિવસથી ૧૦૮ અભ્યુલન્સના દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે વગાડાતા ભયસુચક હોર્ન લોકોમાં ભયની લાગણી ઉભી કરી દીધી છે. કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી વધી રહ્યું છે તેનો અહેસાસ થઈ રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકો કોરોના ભયને વિસારે પાડીને તહેવારોનો ઉજવણીમાં સર્વે પ્રકારના પાળવાના નિયમોની ઐસીતેસી કરી નાંખી પરિણામે જે સંકટ ઉલ્લબ્ધ થયું છે તે ભયજનક છે.

૧૦૮ની સેવાઓ આપતાં ભાઈઓ-બહેનોને આપણે સલામ મારવી પડે તેઓ જે પ્રકારે જીવના જોખમથી દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જાય છે. સાથે સાથે હોસ્પિટલમાં કામ કરતાં ડોક્ટરો અને નર્સ બહેનોને જે રીતે સેવા આપે છે તેને પણ જીવનાની સેવા માટે ઉપલબ્ધ છે.



ગરવી નવકાન્તિ સાપ્તાહિક વેબ સાઇટ ઉપર જોઈ શકો છો

#kwws=22mdjdglvklkulvwldqlfrp

ઉપરોક્ત વેબ સાઇટ ઉપરાંત ફેસબુક kwws=22idfherrn1frp2urelq1gkrodnld ઉપર પણ જોઈ શકાશે.



ગરવી નવકાન્તિ

લોકોમાંથી કોરોનાની દહેશત દુર કરવા માટે સરકાર દ્વારા ગંભીરતાપુર્વક વિચારવાના બધાં કેટલાક એવા નિર્ણયો લેવાયા જેના પરિણામે અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વ્યાપી ગયો. કોરોનાનું સાચું ચિત્ર ઢાંકીને સરકારે જ લોકોની ભીડને પ્રોત્સાહિત કરી. પરિણામે લોકો ગેરમાર્ગ દોરાયા અને સંકમણ એકદમ પુર જોશમાં વધી ગયું. સરકારે સંકમણના આંકડાઓ છુપાવ્યા જેથી લોકોના મનમાંથી દહેશતનો માહોલ દુર થયો. જાણેકે આપણે કોરોનાને મહાત કરીને તેને નાશ કરી દીધો છે. પરંતુ એવું લેશ માત્ર થયું નહિ. આર્થિક રીતે પાયમાલ થયેલા બજારોને દોડતા કરવા માટે લોકોને છુટછાટો આપી પરિણામે લોકોનું ઘોડાપુર ઉમટયું. બજારોમાં તેજાનો અણસાર દેખાયો જેથી રાજકારણીઓને હાશકારો અનુભવ્યો કે હવે બધું ઠકાણે આવી જશે. બજારોમાં જે કૃતિમ તેજ લાવવામાં આવી જેથી લોકોમાં અર્થતંત્રની ગાડી પુરજોશમાં દોડવા લાગી છે તેવું વર્તાવા લાગ્યું પરંતુ તે માત્ર થોડાક સમય પુરતું જ છે. સરકારે કોરોનાના કેશ ઓછા બતાવ્યા. પરિણામે લોકોના મનમાંથી એક ડર જતો રહ્યો. હવે કોરોનાનો ભય નથી તેમ લોકો માનવા પ્રેરાયા. બેફીકર બન્યા. સાવચેતીની સભાનતા ગઈ. સરકારે જ તેમને પ્રોત્સાહિત કર્યા. એટલે સુધી કે ઘણા પોતાને કોરોના હોય તો પણ જાળવવાની તસ્તી લેતા નથી. જ્યારે અનેક એવા છે કે જે મને કોરોનાના લક્ષણો હોવા છતાં ટેસ્ટ કરાવવાનું ટાળે છે. ભય ગયો એટલે છુટથી જહેરમાં ફરવા લાગ્યા. તહેવારોમાં સામાજિક પરંપરા જાળવવાના ઉત્સાહમાં કોરોનાના ભયની ગેરહાજરી કારણારૂપ બની. સરકારે સતત કોરોનાના સાચા આંકડા આપ્યા હોતાં લોકોમાં ભયઅને તે નિમિત્ત સાવચેતીની ચિંતા યથાવત રહી હોત. તો કદાચ આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ના થાત.

કોરોના પર કાબુ મેળવવા માટે કાયદાથી કામ નહીં ચાલે પણ દરેક નાગરિક પોતાની જવાબદારી સમજ માસ્ક અને સોશયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. દરેક નાગરિક કામ વિના ધરની બહાર ની કળવાનું ટાળે, ધરની બહાર નીકળે તો ફરજીયાત માસ્ક પહેરે. સોશયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને વારંવાર હાથ ધુઅ કે સેનેટાઇઝ કરે તો જ કોરોનાનું સંકમણ નાથી શકાય તેમ છે.

સરકાર માત્ર રાત્રિ કરક્કું અમલી બનાવી કેમ અટકી છે તે એક સવાલ છે. મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટર્સ, ખાંડીપીણીના બજારો અને એવા સ્થળો જ્યાં મોટી સંખ્યામાં લોકો સતત ભેગા થતા હોય તેને પણ તાકીદ બંધ કરાવી દેવા ઓઈએ. પરંતુ સરકારે હજુ સુધી તેમ કરવા વિચાર્યું નથી. તો સરકાર કોની રાહ જુઓ છે તે મુખ્ય ચિંતાનો વિષય છે.

સતત એમ્બ્યુલન્સના સાયરનો સંભળાઈ રહ્યા છે. છતાં આપણા મનોમાં કોઈ દહેશત ઉભી થતી નથી. કારણકે કોરોના વાયરસનો ચેપ અન્ય કોઈને લાગ્યો છે. આપણે તેમાંથી બોધપાઠ લેવા માટે તૈયાર બનવું પડશે. માસ્ક પહેરવા, સોશયલ ડિસ્ટન્સિંગ જાળવવા કમર કસવી પડશે. બેધ્યાન લોકોનું ધ્યાન દોરવું પડશે. વધુ પડતું સંકમણ ફેલાતું રોકવા માટે તમામ પગલાં લેવામાં આપણા પોતાથી બનતા પ્રયત્નોમાં સામેલ થવું પડશે.

સરકાર તરફથી બહાર પડાયેલા આંકડાઓમાં હોસ્પિટલોમાં કેટલી સેવાઓ ઉપલબ્ધ છે અને એડ ખાલી છે તેની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ ત્યાં પ્રેક્ટીકલી જઈને જોઈએ તો સત્તાવાળાઓ તરફથી એવું કહેવાય છે કે જગ્યા ખાલી નથી અન્ય કોઈ હોસ્પિટલમાં ટ્રાય કરો. પરિણામે સરકારી જાહેરાતો પોકળ લાગે છે. ખરેખર સામાન્ય નાગરિકોને ખુબજ કડવા અનુભવો થયા છે. માત્ર શ્રીમંત અને મેડિકલ કલેમ દ્વારા નાણાં આપી શકે તેવા દરદીઓને લાભો મળ્યા છે. સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે દર્દીએ કેટલાક રાજનેતાઓની ભલામણ કરવી પડે છે ત્યારે એન્ટ્રી મળે છે. વા.સા.હોસ્પિટલમાંથી ભવ્ય બનાવેલી હોસ્પિટલમાં સામાન્ય દર્દીને દાખલ કરાવવા માટે દર્દીના સગાઓએ કાકલુદી કરવી પડે તેના માટે આવી કોપરેટ હોસ્પિટલો તૈયાર કરવાની કોઠાસુઝને લાત મારવી પડે. કોરપોરેટ વિકાસ સામાન્ય નાગરિક માટે વામણો પુરવાર થયો છે.

જાહેર ખબરના ખાલ

આખુ પાન	રૂ. ૧૦૫૦૦	અધું પાન	રૂ. ૫૦૦૦
૧/૪ પાન	રૂ. ૨૫૦૦	૧/૮ પાન	રૂ. ૧૦૦૦
વાર્ષિક પેનલ	રૂ. ૭૨૦૦	માસિક પેનલ	રૂ. ૧૦૦૦
ટચુકડી જાહેરાત રૂ. ૫૦૦			

વ્યવસાયિક જા.ખ. રૂ. ૬૦ કો.સે.મી.

આપણી કોઇપણ પ્રકારની જાહેર ખબરો સંપૂર્ણ વિગત સાથે મોકલી આપી, વિશાળ વાયક વગ સુધી પહોંચાડો. જાહેરખબર દર મંગળવારે કાયદાલય પર પહોંચાડવી સંપર્ક : ૯૮૨૫૨ ૯૬૩૮૬, ૦૭૯-૬૫૨૯૪૭૫૯

આઇપીએલ-૨૦૨૦ની ટેવન્ટી ટેવન્ટી કિકેટ

ટુનામેન્ટમાં મુંબઇની ટીમ ચેમ્પીયન બની



આઇપીએલ-૨૦૨૦ ટેવન્ટી ટેવન્ટી કિકેટની ચેમ્પીયન મુંબઇ ટીમનું એક સામુહિક દ્રશ્ય જેમાં વિજયના ભાગીદાર સહૃદી ટીમ સભ્યો દેખાય છે.

બધાજ પ્રકારના અપમાન એસસી-એસ્ટી એકટ અંતગત અપરાધ ગણાય નહીં : સવર્ણ વ્યક્તિને તેના કાયદાકીય અધિકારોથી વંચિત ન રહ્યું રહ્યું હોય નથી

સુપ્રીમ કોર્ટ એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે અનુસુચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિની વ્યક્તિને ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણનો તેના કાયદે સરના અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. એસસી-એસ્ટી સમુદાયોને જાતિવાદ સામે સંરક્ષણ આપાતા સુપ્રીમ કોર્ટ જણાવ્યું હતું કે એસસી-એસ્ટી સમુદાયના વ્યક્તિને ફરિયાદ કરી છે ફક્ત તેના આધારે કોઈની પણ સામે એસસી-એસ્ટી એકટ અંતગત ખટલો ચલાવી શકાય નહીં.



સુપ્રીમ જણાવ્યું કે સામેની વ્યક્તિની જાતિની જાણ હોવી એ કોઈ અપરાધ નથી. કોઈપણ વ્યક્તિને કાયદા અંતગત સ્થાપિત પ્રક્રિયા દ્વારા પોતાના અધિકારોની સુરક્ષાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના અર્થધટનને કારણે અનેક એવા કેસો ઉભા થયેલા છે તેનો નિકાલ આવી જશે.

ગ્લોરી કેટરીંગ સર્વીસ

આપણે ત્યાં ઉજવાતા માંગલિક પ્રસંગો જેવાકે સગાઈ, લગ્ન, રિસેપ્શન, લયડ પાર્ટી તથા નાના મોટા જમણાવારોમાં જમણાં અંગોની તમામ વ્યવસ્થા વ્યાજબી ભાવે કરી આપીશું.

શુદ્ધ, સાત્વીક, રવાદિષ્ટ રસોદ માટે એકવાર મુલાકાત ગોફવો અને નિશ્ચિત બની આપના પ્રસંગનો અનેરો આનંદ માણો

ચિંતા વગારનો પ્રસંગ એ જ પ્રસંગનો આનંદ

‘હુઃખમાં જો સુખની અનુભૂતિ ઈચ્છા છો તો હસમુખા બનો’ એવી સંતવાણી છે. હાસ્ય માણસના હુઃખને ઓગળાણી નાંખે છે. માનસિક કે શારીરિક હુઃખ માણસને ખતમ કરી શકે છે. એમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે. તાણમુક્ત બનીને, હસતા રહો. બેને કહું છે: ‘હસમુખો સ્વભાવ દીર્ઘ જીવનનું એક સર્વોત્તમ સાધન છે’ જેનો સ્વભાવ હસમુખો છે, એ માણસ પોતાના વિરોધની નકારાત્મક વાતને પણ હકારાત્મક બનાવી દેતો હોય છે. હસમુખો માણસ ક્યારેય કોઈની વાતનું બુઝ માનતો નથી. તે તો બુરી વાતને પણ હસવામાં લઈ લે છે. આપણે જીથીએ છીએ કે, ખોટી તાણ અનુભવવાથી આપણા શરીરને જ હાનિ થતી હોય છે. હસવાથી મનમસ્તિકની તાણ ઓછી થાય છે. જે નિર્દેશ અને નિર્દોષ રીતે હસી શકે છે, એના જીવનાં કોઈપણ પ્રકારની તાણ આવતી નથી. કોઈપણ વાતને હસી કાઢવી એ મોટી ઘટના છે. નિર્દોષ હાસ્યથી શું થાય ? થેકરે કહું છે : સારુ નિર્દોષ હાસ્ય ઘરમાં સુર્યધીએમ અજવાણું પાથરે છે. આમાં હાસ્યની જે ક્ષમતા છે એનો નિર્દેશ કર્યો છે. હસતા રહો, જીવતા રહો, એ હાસ્ય કેવું ? માત્ર હોઠોનું કે હદયનું ? જે માત્ર હસવા ખાતર હસે છે એવા

હસમુખો સ્વભાવ દીર્ઘ જીવનનું એક સર્વોત્તમ સાધન છે

હાસ્યની જરૂર નથી. આપણું હાસ્ય પણ હદયમાંથી આવવું જોઈએ. જે બીજાના હદયને સ્પર્શી શકે. વિકટર હુંગોએ કહું છે : મને હોઠ અને હદયને ખોલી દે એવું હાસ્ય પ્રિય છે. તથા એ સમયે દાંત અને આત્માનું દર્શન કરાવે છે. માત્ર દાંત દેખાડવાની વાત નથી. પણ આત્માના પણ એમાં દર્શન થાય, એવા હાસ્યની વાત છે. હાસ્યન પણ એક આભા હોય છે. પ્રભાવ હોય છે. જે માણસ હદયના હદયમાં પડતો હોય છે. કાર્લાઈલે કહું છે : કોઈપણ માણસ જો હિલ ખોલીને હસ્યો હોય, બિલ્કુલ એવો દુરાચારી હોઈ શકે નહીં જેનો પુનઃ સુધાર થઈ ન શકે. પ્રેમથી પશુ-પ્રાણી પણ વશ થાય છે. હાસ્યથી માણસનું હદય પરિવર્તન થઈ શકે છે. બીજાના મનમાં વળેલી જે ગાંઠો છે એ છુટી શકે છે. હાસ્યથી તો પુર્વગણો મટી શકે છે. હાસ્ય તો ઉતામ ટોનિક છે. હાસ્યથી માણસ જગતમાં લોકપ્રિયતા પામી શકે છે.

સંત પેમનાએ કહું છે : કોઈ કહે કે, જમીન મારી મિલકત છે, તો જમીન હસી પડે છે. કંજુસને જોઈને ધન હસી પડે છે. અને રણથી ડરવાવાને જોઈ

કાળ અહૃહાસ્ય કરે છે. માણસને જેવો ભાવ એવી એમની ભાવના. હાસ્યકાર બીજાને હસાવતો હોય છે. પોતે ગંભીર રહેતો હોય છે. જો પોતે જ હસવા માંડે તો હાસ્યની મજા મરી જાય છે. શિલરે કહું છે : જ્યારે જોકર સ્વયં હસી પડે છે તો હાસ્યની મજા મરી જાય છે. આ તો જોકરની વાત થઈ, પણ સંસારમાં જોકર જેવા ઘણા લોકો જોવા મળતા હોય છે. જે પોતે જ હાસ્યનું પાત્ર બનાતા હોય છે. હાસ્ય તો નિરાશાની ગર્તમાં દુબી ગયેલા માણસની આશાનું કિરણ છે. કોઈએ કહું છે : સિમત થાકેલા માટે વિશ્રામ છે. હતોત્સાહ માટે દિવસનો પ્રકાશ છે. ઉદાસ માટે ધૂપ અને સુખી માટે પ્રકૃતિનો સર્વોત્તમ પ્રતિકાર છે. આપણું એકાદ સિમત બીજાને જીંદગી જીવવાનો ટેકો પુરો પાડી શકે છે. શેક્સપિયરે તેથી તો કહું છે કે, તમારે શું જોઈએ છે? જે કંઈ પણ જોઈએ તે સિમતથી પ્રામ કરો. જોર જુલમથી નહીં. કોઈપણ વસ્તુ આપણે જોર જુલમથી મેળવી શકીએ નહીં. જોર જુલમથી મેળવેલ લાંબો સમય ટકતી નથી. પણ જે પ્રેમથી મળે છે. તે કાયમી હોય છે. કોઈ હુઃખીને આપણું એકાદ સિમત એના જીવનને

અજવાણી શકું હોય તો એનો આનંદ કેવો હોય ? કોઈને તમે કશું જ આપી શકો એમ ન હોવ તો એકાદ સિમત આપો. ચાર્લ્સ ડિકન્સ કહું છે : જો આપણે જીવનપંથ પર પુષ્પો બીજાવી ન શકીએ તો ઓછામાં ઓછું સિમત પાથરી શકીએ છીએ. સિમતનો પ્રભાવ કેટલો મહાન છે. એ એમાંથી પ્રગટ થાય છે. આજના જે યંત્રો ચાલે છે. એમાંથી એકાદ ભાગ જો ખોરવાઈ જાય તો યંત્રની ગતિ બંધ થઈ જાય છે. આપણું શરીર પણ એક યંત્ર છે. હાસ્ય એ યંત્રનો ભાગ છે. તેના અભાવથી જીવનરૂપી યંત્ર ખોટકાઈ જાય છે. આપણું જીવનરૂપી યંત્ર ખડકી ના પડે એ માટે તેમાં હાસ્યરૂપી દિવેલ ઉંઝતા રહેવું પડે છે.

માણસથી માણસને જોડવાનું કામ હાસ્ય કરે છે. કોઈ અપરિચિત હોય, એની સામે સિમત આપો. થોડા સમય પછી તમે એકબીજાની નજીક જશો. હાસ્ય તો જીવનનો બગ્યાચો છે. એમાં આનંદરૂપી ફુલો ખીલતા રહે અને આપણા જીવનને સુગંધમય બનાવતા રહે છે. મહાત્મા વોલટને કહું છે : હાસ્ય એક અદ્ભુત ઔષધ છે. જે પદ્ધતિ ના પડે એ માટે તેમાં હાસ્યરૂપી બણ મળે છે. આ હુઃખી સંસારમાં

હાસ્યસિવાય બીજુ મોહું અસરકારક ઔષધ કર્યું હોઈ શકે ? માણસ જ્યારે ખડખડાટ હસી પડે છે, ત્યારે એના ચહેરા ઉપર ગુલાબના પુષ્પો ઉગી નીકળે છે. જે ચહેરો ક્યારેય હસી ન શકે તો ક્યારેય બીજી શકતો નથી. હાસ્ય તો અંતરમાંથી વહેતું ઝરણું છે. ગમે ત્યા જાઓ, જો હસતા રહેશો તો તમનો ઘણા લોકો આવકારશે. તમને મળવા તત્પરતા દાખવશે. પણ જો દિવેલ પીધેલા જેવો ચહેરો લઈને ફરશો તો તમારી સામે જોનાર કોઈ જ નહીં હોય. વિનોદવૃત્તિ જ જીવનનો રસ છે. એ રસમાં અન્યને પણ ભાગીદાર બનાવો તો એનો આનંદ બેવડાઈ જશો. થેકરે તો કહું છે : હાસ્ય એક અદ્ભુત પોષાક છે. જે દરેક જગ્યાએ પહેરી શકાય છે. હાસ્યને ભાગાની જરૂર નથી. એ દરેક દેશ-કાળમાં હોઈ શકે છે. હાસ્ય કોઈ તલવારના જોરથી મેળવી શકતું નથી. હસતા રહેશો જે મેળવી શકાય છે એ કાયમી યાદ રહે છે. ધનદોલત હોય, પણ હસી શકતા ન હોય તો એનો શો અર્થ ? રેમંડ હિયકોકે કહું છે : જે વ્યક્તિ મુક્ત રીતે હસી શકે છે તે ગરીબ નથી. વિશ્વમાં હાસ્ય જેવી બીજી કોઈ સમૃદ્ધિ હોઈ શકે જ નહીં. હાસ્ય માણસને દિલથી દિલને જોડે છે. પાસે લાવે છે, એકાકાર બનાવે છે.

ડૉ. કિશોરસિંહ સોલંકી
(સૌ. સંદેશ)

મીડીયા, પ્રિન્ટ મીડીયા, આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદન એકમો, જાહેર ઉપયોગીતા જેવી કે પ્રેલીયમ, સીએલજી, એલપીજી, પીએલજી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન, ટેલી કોમ્યુનિકેશન, પ્રારંભિક યેતવણી એજન્સી, વિગેરે. અંતિમ સંસ્કારના કિસ્સામાં વીસ જેટલા વ્યક્તિઓ, લગ્ન પ્રસંગે પોલીસ પરવાનગી અનુસાર, રેલવે-એરપોર્ટ સાફર કરનારા યાત્રીઓ માન્ય ટીકીટ રજુ કરવાથી મંજુરી, ટેક્સી તથા રેડિયો કેબ સેવાઓ ચાલુ રહેશે. માન્ય પરિક્ષાઓ આપવા જતા વિદ્યાર્થીઓ પ્રવેશપત્ર-ઓળખપત્રના આધારે લેવા મુકવા માટેની મંજુરી, આ ઉપરાંત કાયદા મુજબ જેને મંજુરી મળી હોય

બધાજ પ્રકારના આપમાન એસસી-એસટી એકટ અંતગાર્ત અપરાધ ગણાયા નાંની : સર્વરી વ્યક્તિને તેના કાયદાકીય અધિકારોથી વંચિત ન રાખી શકાય ચુગીમ કોઈ



ચુકાદો લખતાં જસ્તીસ હેમંત ગુમાએ જાણાયું હતું કે અનુસુચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિની વ્યક્તિને ફિરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્જને તેના કાયદેસરના અધિકારોથી વંચિત રાખી શકાય નાંની. એસસી